

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ. કૃ. યુ., દેવાતજ દ્વારા 'દૂધ અને દૂધની બનાવટો' વિશેની ઓનલાઇન તાલીમ યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજ દ્વારા 'દૂધ અને દૂધની બનાવટો' વિશેની તા. ૨૭.૦૫.૨૦૨૧ ગુરુવારના રોજ ઓનલાઇન તાલીમ કરવામાં આવી. આ કાર્યક્રમમાં કામઘેનુ યુનિવર્સિટીના એસ.એમ.સી. ડેરી કોલેજ ના મદદનીશ પ્રાધ્યાપક ડો. અમિત પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. એ.સી. વૈદ્ય દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કર્યું. તેવોએ દૂધ ની વિશેષતા વિશે વાત કરી અને દૂધ બધાજ લોકો માટે સંપૂર્ણ આહાર તરીકે ઓળખાય એ જનાઉ. ત્યારબાદ કામઘેનુ યુનિવર્સિટી, આણંદ ના એસ.એમ.સી. ડેરી સાયન્સ કોલેજ ના મદદનીશ પ્રાધ્યાપક ડો. અમિત પટેલે દૂધ ની વિવિધ બનાવટો જેવી કે બાસુંદી, ગુલાબજામુન, રસગુલ્લા, બરફી, ઘી, પનીર, છન્ના, માવો, દહીં, છાશ વિગેરે વિશે વિસ્તૃત માં ચર્ચા કરી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજના પશુપાલન ના વૈજ્ઞાનિક ડો. શ્રીકાંત કાટોલે દ્વારા ઉનાળામાં પશુઓમાં લેવાની કાળજી અને પાણી નું મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી. તેઓ એ કોરોના ની મહામારી માં સાવચેતી ના પગલાં વિશે પણ વાત કરી. કે. વિ. કે. દેવાતાજ ના પ્રોગ્રામ એસિસ્ટન્ટ હોમ સાયન્સ અંજલી જાદવે દૂધ ના પોષક તત્વો વિશે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમ ઓનલાઇન પ્લેટફોર્મ ગુગલ મીટ પર કરવામાં આવ્યો હતો જેમાં આણંદ જિલ્લાનાં કુલ ૩૬ ખેડૂત ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો શ્રીકાંત કાટોલે દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની અંતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફિશરીઝના વૈજ્ઞાનિક શ્રી જૈમીન ભટ્ટે સર્વે ખેડૂત ભાઈઓ તેમજ બહેનો તથા કાર્યક્રમમાં જોડાયેલ અધિકારીશ્રીઓનું અને કેવિકેના સ્ટાફનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી.

કાર્યક્રમ ની ઝાકીઓ

